

Rev

Chapter 18

Gujarati Interlinear

Reference: American Standard Version

- 1 Μετὰ ταῦτα εἶδον ἄλλον ἄγγελον καταβαίνοντα ἐκ τοῦ οὐρανοῦ, ἔχοντα
પછી આ મેં-જોયું બીજો દૂત ઊતરતો માંથી તે આકાશમાંથી જેની-પાસે-હતો
[G3326](#) [G3778](#) [G3708](#) [G0243](#) [G0032](#) [G2597](#) [G1537](#) [G3588](#) [G3772](#) [G2192](#)
- ἐξουσίαν μεγάλην; καὶ ἡ γῆ ἐφωτίσθη ἐκ τῆς δόξης αὐτοῦ.
અધિકાર મોટો અને આ પૃથ્વી પ્રકાશિત-થઈ માંથી તેની મહિમાથી તેની
[G1849](#) [G3173](#) [G2532](#) [G3588](#) [G1093](#) [G5461](#) [G1537](#) [G3588](#) [G1391](#) [G0846](#)

After these things I saw another angel coming down out of heaven, having great authority; and the earth was lightened with his glory.

- 2 καὶ ἔκραξεν ἐν ἰσχυροῦ φωνῇ, λέγων, Ἔπεσεν, ἔπεσεν Βαβυλῶν ἡ
અને પોકાર્યો મિ શક્તિશાલી અવાજે કહેતાં પડ્યું પડ્યું બાબેલોન તે
[G2532](#) [G2896](#) [G1722](#) [G2478](#) [G5456](#) [G3004](#) [G4098](#) [G4098](#) [G0897](#) [G3588](#)
- μεγάλη! καὶ ἐγένετο κατοικητήριον δαιμονίων, καὶ φυλακὴ παντὸς πνεύματος
મોટું અને થયું નિવાસસ્થાન દૈત્યોનું અને કેદ દરેક આત્મા
[G3173](#) [G2532](#) [G1096](#) [G2732](#) [G1140](#) [G2532](#) [G5438](#) [G3956](#) [G4151](#)
- ἀκαθάρτου, καὶ φυλακὴ παντὸς ὀρνέου ἀκαθάρτου, «καὶ φυλακὴ παντὸς θηρίου
અશુદ્ધનું અને કેદ દરેક પંખી અશુદ્ધનું અને કેદ દરેક પશુ
[G0169](#) [G2532](#) [G5438](#) [G3956](#) [G3732](#) [G0169](#) [G2532](#) [G5438](#) [G3956](#) [G2342](#)
- ἀκαθάρτου» καὶ μεμισημένου.
અશુદ્ધનું અને ઘિક્કારાયેલું
[G0169](#) [G2532](#) [G3404](#)

And he cried with a mighty voice, saying, Fallen, fallen is Babylon the great, and is become a habitation of demons, and a hold of every unclean spirit, and a hold of every unclean and hateful bird.

- 3 ὅτι ἐκ τοῦ οἴνου τοῦ θυμοῦ τῆς πορνείας αὐτῆς, πέπωκαν πάντα
કારણ-કે માંથી આ દ્રાક્ષારસથી તે ક્રોધથી આ વ્યભિચારનો તેનો પીધો-હતો બધી
[G3754](#) [G1537](#) [G3588](#) [G3631](#) [G3588](#) [G2372](#) [G3588](#) [G4202](#) [G0846](#) [G4095](#) [G3956](#)
- τὰ ἔθνη; καὶ οἱ βασιλεῖς τῆς γῆς μετ' αὐτῆς ἐπόρνευσαν; καὶ οἱ
આ પ્રજાઓએ અને આ રાજાઓએ આ પૃથ્વીના સાથે તેની વ્યભિચાર-કર્યો અને આ
[G3588](#) [G1484](#) [G2532](#) [G3588](#) [G0935](#) [G3588](#) [G1093](#) [G3326](#) [G0846](#) [G4203](#) [G2532](#) [G3588](#)
- ἔμποροι τῆς γῆς ἐκ τῆς δυνάμεως τοῦ στρήνου αὐτῆς, ἐπλούτησαν.
વેપારીઓ આ પૃથ્વીના માંથી આ સામર્થ્યથી તેની વિલાસિતાની તેની ધનવાન-થયા
[G1713](#) [G3588](#) [G1093](#) [G1537](#) [G3588](#) [G1411](#) [G3588](#) [G4764](#) [G0846](#) [G4147](#)

For by the wine of the wrath of her fornication all the nations are fallen; and the kings of the earth committed fornication with her, and the merchants of the earth waxed rich by the power of her wantonness.

4 Καὶ ἤκουσα ἄλλην φωνὴν ἐκ τοῦ οὐρανοῦ, λέγουσαν, Ἐξέλθατε ὁ λαός
 અને મેં-સાંભળ્યો બીજો અવાજ માંથી તે આકાશમાંથી કહેતો નીકળો હે લોકો
[G2532](#) [G0191](#) [G0243](#) [G5456](#) [G1537](#) [G3588](#) [G3772](#) [G3004](#) [G1831](#) [G3588](#) [G2992](#)

μου, ἐξ αὐτῆς, ἵνα μὴ συνκοινωνήσητε ταῖς ἀμαρτίαις αὐτῆς, καὶ ἐκ
 મારા માંથી તેમાંથી કે નહીં ભાગીદાર-થાઓ આ પાપોમાં તેમના અને માંથી
[G1473](#) [G1537](#) [G0846](#) [G2443](#) [G3361](#) [G4790](#) [G3588](#) [G0266](#) [G0846](#) [G2532](#) [G1537](#)

τῶν πληγῶν αὐτῆς, ἵνα μὴ λάβητε;
 આ આફતો તેમની કે નહીં મેળવો
[G3588](#) [G4127](#) [G0846](#) [G2443](#) [G3361](#) [G2983](#)

And I heard another voice from heaven, saying, Come forth, my people, out of her, that ye have no fellowship with her sins, and that ye receive not of her plagues:

5 ὅτι ἐκολλήθησαν αὐτῆς αἱ ἀμαρτίαι ἄχρι τοῦ οὐρανοῦ, καὶ
 કારણ-કે જોડાયાં-છે તેમના આ પાપો સુધી તે આકાશમાં અને
[G3754](#) [G2853](#) [G0846](#) [G3588](#) [G0266](#) [G0891](#) [G3588](#) [G3772](#) [G2532](#)

ἐμνημόνευσεν ὁ Θεὸς τὰ ἀδικήματα αὐτῆς.
 યાદ-કર્યા તે ઈશ્વરે આ અન્યાયો તેના
[G3421](#) [G3588](#) [G2316](#) [G3588](#) [G0092](#) [G0846](#)

for her sins have reached even unto heaven, and God hath remembered her iniquities.

6 ἀπόδοτε αὐτῇ ὡς καὶ αὐτὴ ἀπέδωκεν; καὶ διπλώσατε τὰ διπλᾶ, κατὰ
 આપો તેને જેમ પણ તેણે આપ્યું અને બમણો-આપો તે બવડું પ્રમાણે
[G0591](#) [G0846](#) [G5613](#) [G2532](#) [G0846](#) [G0591](#) [G2532](#) [G1363](#) [G3588](#) [G1362](#) [G2596](#)

τὰ ἔργα αὐτῆς. ἐν τῷ ποτηρίῳ ᾧ ἐκέρασεν, κεράσατε αὐτῇ διπλοῦν.
 તેન□ કાર્યો તેન□ માં જે ખાલામાં જેમાં મિશ્રિત-કર્યું મિશ્રિત-કરો તેને બવડું
[G3588](#) [G2041](#) [G0846](#) [G1722](#) [G3588](#) [G4221](#) [G3739](#) [G2767](#) [G2767](#) [G0846](#) [G1362](#)

Render unto her even as she rendered, and double unto her the double according to her works: in the cup which she mingled, mingle unto her double.

7 ὅσα ἐδόξασεν αὐτὴν καὶ ἐστρηνίασεν, τοσοῦτον δότε αὐτῇ βασανισμόν καὶ
 જેટલું મહિમા-આપી તેએ અને વિલાસિતા-કરી તેટલું આપો તેને યાતના અને
[G3745](#) [G1392](#) [G0848](#) [G2532](#) [G4763](#) [G5118](#) [G1325](#) [G0846](#) [G0929](#) [G2532](#)

πένθος. ὅτι ἐν τῇ καρδίᾳ αὐτῆς λέγει ὅτι, Κάθημαι βασίλισσα, καὶ
 શોક કારણ-કે માં તેના હૃદયમાં તેન□ કહે-છે કે બેઠી-છું રાણી અને
[G3997](#) [G3754](#) [G1722](#) [G3588](#) [G2588](#) [G0846](#) [G3004](#) [G3754](#) [G2521](#) [G0938](#) [G2532](#)

χήρα οὐκ εἰμί, καὶ πένθος οὐ μὴ ἴδω.
 વિધવા નથી હું અને શોક નહીં કદી જોઈશ
[G5503](#) [G3756](#) [G1510](#) [G2532](#) [G3997](#) [G3756](#) [G3361](#) [G3708](#)

How much soever she glorified herself, and waxed wanton, so much give her of torment and mourning: for she saith in her heart, I sit a queen, and am no widow, and shall in no wise see mourning.

8 διὰ τοῦτο, ἐν μιᾷ ἡμέρᾳ ἤξουσιν αἱ πληγαὶ αὐτῆς, θάνατος καὶ
 તેથી આ-કારણે એક એક-જ દિવસમાં આવશે તેની આફતો તેની મરણ અને
[G1223](#) [G3778](#) [G1722](#) [G1520](#) [G2250](#) [G2240](#) [G3588](#) [G4127](#) [G0846](#) [G2288](#) [G2532](#)

πένθος καὶ λιμός, καὶ ἐν πυρὶ κατακαυθήσεται; ὅτι ἰσχυρὸς Κύριος ὁ
 શોક અને દુકાળ અને વડે અગ્નિથી બળી-જશે કારણ-કે શક્તિશાળી પ્રભુ તે
[G3997](#) [G2532](#) [G3042](#) [G2532](#) [G1722](#) [G4442](#) [G2618](#) [G3754](#) [G2478](#) [G2962](#) [G3588](#)

Θεὸς ὁ κρίνας αὐτήν.
 ઈશ્વરે જેણે ન્યાય-કર્યો તેને
[G2316](#) [G3588](#) [G2919](#) [G0846](#)

Therefore in one day shall her plagues come, death, and mourning, and famine; and she shall be utterly burned with fire; for strong is the Lord God who judged her.

- 9 καὶ κλαύσουσιν καὶ κόψονται ἕα' αὐτήν, οἱ βασιλεῖς τῆς γῆς, οἱ
અને રડશે અને શોક-કરશે માટે તેન, આ રાજાઓ આ પૃથ્વીન, જેઓએ
[G2532](#) [G2799](#) [G2532](#) [G2875](#) [G1909](#) [G0846](#) [G3588](#) [G0935](#) [G3588](#) [G1093](#) [G3588](#)
- μετ' αὐτῆς πορνεύσαντες καὶ στρηνιάσαντες, ὅταν βλέπωσιν τὸν καπνὸν τῆς
સાથે તેની વ્યભિચાર-કર્ચો અને વિલાસિતા-કરી જ્યારે જુએ તે ધૂમાડો આ
[G3326](#) [G0846](#) [G4203](#) [G2532](#) [G4763](#) [G3752](#) [G0991](#) [G3588](#) [G2586](#) [G3588](#)
- πυρώσεως αὐτῆς,
બળવાનો તેનો
[G4451](#) [G0846](#)

And the kings of the earth, who committed fornication and lived wantonly with her, shall weep and wail over her, when they look upon the smoke of her burning,

- 10 ἀπὸ μακρόθεν ἔστηκότες διὰ τὸν φόβον τοῦ βασανισμοῦ αὐτῆς, λέγοντες,
દૂરથી દૂર ઊભેલા કારણે તે ભયથી આ યાતનાન, તેની કહેતાં
[G0575](#) [G3113](#) [G2476](#) [G1223](#) [G3588](#) [G5401](#) [G3588](#) [G0929](#) [G0846](#) [G3004](#)
- Οὐαὶ, οὐαὶ, ἡ πόλις ἡ μεγάλη, Βαβυλῶν, ἡ πόλις ἡ ἰσχυρά! ὅτι
હાય હાય તે શહેર તે મોટું બાબેલોન તે શહેર તે શક્તિશાળી કારણ-કે
[G3759](#) [G3759](#) [G3588](#) [G4172](#) [G3588](#) [G3173](#) [G0897](#) [G3588](#) [G4172](#) [G3588](#) [G2478](#) [G3754](#)
- μῖθ' ὥρα ἦλθεν ἡ κρίσις σου.
એક-જ કલાકમાં આવ્યો તારો ન્યાય તારો
[G1520](#) [G5610](#) [G2064](#) [G3588](#) [G2920](#) [G4771](#)

standing afar off for the fear of her torment, saying, Woe, woe, the great city, Babylon, the strong city! for in one hour is thy judgment come.

- 11 καὶ οἱ ἔμποροι τῆς γῆς κλαίουσιν καὶ πενθοῦσιν ἕα' αὐτήν, ὅτι
અને આ વેપારીઓ આ પૃથ્વીના રડે-છે અને શોક-કરે-છે માટે તેન, કારણ-કે
[G2532](#) [G3588](#) [G1713](#) [G3588](#) [G1093](#) [G2799](#) [G2532](#) [G3996](#) [G1909](#) [G0846](#) [G3754](#)
- τὸν γόμον αὐτῶν, οὐδεὶς ἀγοράζει οὐκέτι --
તેમનો માલસામાન તેમનો કોઈ-નથી ખરીદતું હવેથી
[G3588](#) [G1117](#) [G0846](#) [G3762](#) [G0059](#) [G3765](#)

And the merchants of the earth weep and mourn over her, for no man buyeth their merchandise any more;

- 12 γόμον χρυσοῦ, καὶ ἀργύρου, καὶ λίθου τιμίου, καὶ μαργαριτῶν, καὶ
માલસામાન સોનાનું અને ચાંદીનું અને રત્નનું કીમતી અને મોતીનું અને
[G1117](#) [G5557](#) [G2532](#) [G0696](#) [G2532](#) [G3037](#) [G5093](#) [G2532](#) [G3135](#) [G2532](#)
- βυσσίνου, καὶ πορφύρας, καὶ σιρικοῦ, καὶ κοκκίνου, καὶ πᾶν ξύλον θύϊνον,
શણનું અને જાંબલીનું અને રેશમનું અને કિરમજીનું અને દરેક લાકડું સુગંધિત
[G1039](#) [G2532](#) [G4209](#) [G2532](#) [G4596](#) [G2532](#) [G2847](#) [G2532](#) [G3956](#) [G3586](#) [G2367](#)
- καὶ πᾶν σκεῦος ἐλεφάντινον, καὶ πᾶν σκεῦος ἐκ ξύλου τιμιωτάτου, καὶ
અને દરેક વાસણ હાથીદાંતનું અને દરેક વાસણ માંથી લાકડાના કીમતીમાં-કીમતી અને
[G2532](#) [G3956](#) [G4632](#) [G1661](#) [G2532](#) [G3956](#) [G4632](#) [G1537](#) [G3586](#) [G5093](#) [G2532](#)
- χαλκοῦ, καὶ σιδήρου, καὶ μαρμάρου,
કાંસાનું અને લોખંડનું અને આરસપાણનું
[G5475](#) [G2532](#) [G4604](#) [G2532](#) [G3139](#)

merchandise of gold, and silver, and precious stone, and pearls, and fine linen, and purple, and silk, and scarlet; and all thyne wood, and every vessel of ivory, and every vessel made of most precious wood, and of brass, and iron, and marble;

- 13 καὶ κιννάμωμον, καὶ ἄμωμον, καὶ θυμιάματα, καὶ μύρον, καὶ λίβανον,
 અને તજનું અને મસાલાનું અને ધૂપનું અને અતરનું અને લોબાનનું
[G2532](#) [G2792](#) [G2532](#) [G0299](#) [G2532](#) [G2368](#) [G2532](#) [G3464](#) [G2532](#) [G3030](#)
- καὶ οἶνον, καὶ ἔλαιον, καὶ σεμίδαλιν, καὶ σῖτον, καὶ κτήνη, καὶ
 અને દ્રાક્ષારસનું અને તેલનું અને મેંદો-લોટનું અને ઘઉંનું અને ગાયોનું અને
[G2532](#) [G3631](#) [G2532](#) [G1637](#) [G2532](#) [G4585](#) [G2532](#) [G4621](#) [G2532](#) [G2934](#) [G2532](#)
- πρόβατα, καὶ ἵππων, καὶ ῥεδῶν, καὶ σωμάτων, καὶ ψυχὰς ἀνθρώπων.
 ઘેટાનું અને ઘોડાનું અને રથોનું અને શરીરોનું અને આત્માઓ માણસોની
[G4263](#) [G2532](#) [G2462](#) [G2532](#) [G4480](#) [G2532](#) [G4983](#) [G2532](#) [G5590](#) [G0444](#)

and cinnamon, and spice, and incense, and ointment, and frankincense, and wine, and oil, and fine flour, and wheat, and cattle, and sheep; and merchandise of horses and chariots and slaves; and souls of men.

- 14 καὶ ἡ ὀπώρα σου, τῆς ἐπιθυμίας τῆς ψυχῆς ἀπῆλθεν ἀπὸ σοῦ, καὶ
 અને આ ફળો તારાં આ ઇચ્છાની આ આત્માની ગઈ-છે માંથી તારી અને
[G2532](#) [G3588](#) [G3703](#) [G4771](#) [G3588](#) [G1939](#) [G3588](#) [G5590](#) [G0565](#) [G0575](#) [G4771](#) [G2532](#)
- πάντα τὰ λιπαρὰ καὶ τὰ λαμπρὰ ἀπώλετο ἀπὸ σοῦ, καὶ οὐκέτι οὐ
 બધી આ ચરબીવાળી અને આ ચમકતી નાશ-થઈ માંથી તારી અને કદીપણ નહીં
[G3956](#) [G3588](#) [G3045](#) [G2532](#) [G3588](#) [G2986](#) [G0622](#) [G0575](#) [G4771](#) [G2532](#) [G3765](#) [G3756](#)
- μη αὐτὰ εὐρήσουσιν.
 કદી તેમને મળશે-નહીં
[G3361](#) [G0846](#) [G2147](#)

And the fruits which thy soul lusted after are gone from thee, and all things that were dainty and sumptuous are perished from thee, and men shall find them no more at all.

- 15 οἱ ἔμποροι τούτων, οἱ πλουτήσαντες ἀπ' αὐτῆς, ἀπὸ μακρόθεν
 આ વેપારીઓ આના જેઓ ધનવાન-થયા માંથી તેની દૂરથી દૂર
[G3588](#) [G1713](#) [G3778](#) [G3588](#) [G4147](#) [G0575](#) [G0846](#) [G0575](#) [G3113](#)
- στήσονται, διὰ τὸν φόβον τοῦ βασανισμοῦ αὐτῆς, κλαίοντες καὶ πενθοῦντες,
 ઊભા-રહેશે કારણે આ ભયથી આ યાતનાન□ તેની રડતાં અને શોક-કરતાં
[G2476](#) [G1223](#) [G3588](#) [G5401](#) [G3588](#) [G0929](#) [G0846](#) [G2799](#) [G2532](#) [G3996](#)

The merchants of these things, who were made rich by her, shall stand afar off for the fear of her torment, weeping and mourning;

- 16 λέγοντες, Οὐαὶ, οὐαὶ, ἡ πόλις ἡ μεγάλη, ἡ περιβεβλημένη βύσσινον,
 કહેતાં હાય હાય તે શહેર તે મોટું જે પહેરેલું-હતું શણ
[G3004](#) [G3759](#) [G3759](#) [G3588](#) [G4172](#) [G3588](#) [G3173](#) [G3588](#) [G4016](#) [G1039](#)
- καὶ πορφυροῦν, καὶ κόκκινον; καὶ κεχρυσωμένη ἐν χρυσίῳ, καὶ λίθῳ
 અને જાંબલી અને કિરમજી અને મહેલું વડે સોનાથી અને રત્નથી
[G2532](#) [G4210](#) [G2532](#) [G2847](#) [G2532](#) [G5558](#) [G1722](#) [G5553](#) [G2532](#) [G3037](#)
- τιμίῳ, καὶ μαργαρίτῃ!
 કીમતી અને મોતીથી□
[G5093](#) [G2532](#) [G3135](#)

saying, Woe, woe, the great city, she that was arrayed in fine linen and purple and scarlet, and decked with gold and precious stone and pearl!

17 ὅτι μιᾷ ὥρᾳ ἠρημώθη ὁ τοσοῦτος πλοῦτος, καὶ παῖς κυβερνήτης,
 કારણ-કે એક-જ કલાકમાં ઉજ્જડ-થયો આ આટલો સંપત્તિ અને દરેક કપ્તાન
[G3754](#) [G1520](#) [G5610](#) [G2049](#) [G3588](#) [G5118](#) [G4149](#) [G2532](#) [G3956](#) [G2942](#)

καὶ παῖς ὁ ἐπὶ τόπον πλέων, καὶ ναῦται, καὶ ὅσοι τὴν θάλασσαν
 અને દરેક જે માં જગ્યાએ વહાણ-ચલાવે અને ખલાસીઓ અને જેટલા આ સમુદ્રમાં
[G2532](#) [G3956](#) [G3588](#) [G1909](#) [G5117](#) [G4126](#) [G2532](#) [G3492](#) [G2532](#) [G3745](#) [G3588](#) [G2281](#)

ἐργάζονται, ἀπὸ μακρόθεν ἔστησαν,
 કામ-કરે-છે દૂરથી દૂર ઉભા-રહ્યા
[G2038](#) [G0575](#) [G3113](#) [G2476](#)

for in one hour so great riches is made desolate. And every shipmaster, and every one that saileth any whither, and mariners, and as many as gain their living by sea, stood afar off,

18 καὶ ἔκραζον, βλέποντες τὸν καπνὸν τῆς πυρώσεως αὐτῆς, λέγοντες, Τίς
 અને બૂμιο-પાડતાં-હતા જોતાં તે ધૂમાડો આ બળવાનો તેનો કહેતાં કોણ
[G2532](#) [G2896](#) [G0991](#) [G3588](#) [G2586](#) [G3588](#) [G4451](#) [G0846](#) [G3004](#) [G5101](#)

ὁμοία τῆ πόλει τῆ μεγάλης?
 સમાન આ શહેરને આ મોટાને?
[G3664](#) [G3588](#) [G4172](#) [G3588](#) [G3173](#)

and cried out as they looked upon the smoke of her burning, saying, What city is like the great city?

19 καὶ ἔβαλον χοῦν ἐπὶ τὰς κεφαλὰς αὐτῶν, καὶ ἔκραζον, κλαίοντες καὶ
 અને નાખી ધૂલ ઉપર તેમના માથાં-પર તેમના અને બૂમો-પાડતાં-હતા રડતાં અને
[G2532](#) [G0906](#) [G5522](#) [G1909](#) [G3588](#) [G2776](#) [G0846](#) [G2532](#) [G2896](#) [G2799](#) [G2532](#)

πενθοῦντες, λέγοντες, Οὐαί, οὐαί, ἢ πόλις ἢ μεγάλη, ἐν ᾗ
 શોક-કરતાં કહેતાં હાય હાય તે શહેર તે મોટું જેમાં જેના-વડે
[G3996](#) [G3004](#) [G3759](#) [G3759](#) [G3588](#) [G4172](#) [G3588](#) [G3173](#) [G1722](#) [G3739](#)

ἐπλοῦτησαν πάντες οἱ ἔχοντες τὰ πλοῖα ἐν τῇ θαλάσῃ ἐκ τῆς
 ધનવાન-થયા બધા જેઓ ધરાવતા-હતા આ વહાણો માં આ સમુદ્રમાં માંથી આ
[G4147](#) [G3956](#) [G3588](#) [G2192](#) [G3588](#) [G4143](#) [G1722](#) [G3588](#) [G2281](#) [G1537](#) [G3588](#)

τιμωρίας αὐτῆς! ὅτι μιᾷ ὥρᾳ ἠρημώθη.
 કીમતથી તેની કારણ-કે એક-જ કલાકમાં ઉજ્જડ-થઈ
[G5094](#) [G0846](#) [G3754](#) [G1520](#) [G5610](#) [G2049](#)

And they cast dust on their heads, and cried, weeping and mourning, saying, Woe, woe, the great city, wherein all that had their ships in the sea were made rich by reason of her costliness! for in one hour is she made desolate.

20 Εὐφραίνου ἐπ' αὐτῆ, οὐρανέ, καὶ οἱ ἅγιοι, καὶ οἱ ἀπόστολοι, καὶ
 આનંદ-કરો માટે તેના-ઉપર હે-આકાશ અને હે સંતો અને હે પ્રેષિતો અને
[G2165](#) [G1909](#) [G0846](#) [G3772](#) [G2532](#) [G3588](#) [G0040](#) [G2532](#) [G3588](#) [G0652](#) [G2532](#)

οἱ προφῆται; ὅτι ἔκρινεν ὁ Θεὸς τὸ κρίμα ὑμῶν ἐξ αὐτῆς.
 હે પ્રબોધકો કારણ-કે ન્યાય-કર્યો તે ઈશ્વરે તે ન્યાય તમારો માંથી તેની
[G3588](#) [G4396](#) [G3754](#) [G2919](#) [G3588](#) [G2316](#) [G3588](#) [G2917](#) [G4771](#) [G1537](#) [G0846](#)

Rejoice over her, thou heaven, and ye saints, and ye apostles, and ye prophets; for God hath judged your judgment on her.

21 Καὶ ἦρεν εἷς ἄγγελος ἰσχυρὸς λίθον, ὡς μύλινον μέγαν, καὶ ἔβαλεν
 અને ઉચ્ચો એક દૂતે શક્તિશાળી પથ્થર, જેવો ઇંટીનો-પથ્થર મોટો અને ડુંક્યો
[G2532](#) [G0142](#) [G1520](#) [G0032](#) [G2478](#) [G3037](#) [G5613](#) [G3458](#) [G3173](#) [G2532](#) [G0906](#)

εἰς τὴν θάλασσαν, λέγων, Οὕτως ὀρμήματα βληθήσεται Βαβυλῶν ἡ μεγάλη
 માં આ સમુદ્રમાં કહેતાં આમ વેગથી ડુંકાશે બાબેલોન તે મોટું
[G1519](#) [G3588](#) [G2281](#) [G3004](#) [G3779](#) [G3731](#) [G0906](#) [G0897](#) [G3588](#) [G3173](#)

πόλις, καὶ οὐ μὴ εὐρεθῆ ἔτι.
 શહેર અને નહીં કદી મળશે કદીપણ
[G4172](#) [G2532](#) [G3756](#) [G3361](#) [G2147](#) [G2089](#)

And a strong angel took up a stone as it were a great millstone and cast it into the sea, saying, Thus with a mighty fall shall Babylon, the great city, be cast down, and shall be found no more at all.

22 καὶ φωνὴ κιθαρῶδων, καὶ μουσικῶν, καὶ αὐλητῶν, καὶ σαλπιστῶν,
 અને અવાજ વીણા-વગાડનારાનો અને સંગીતકારોનો અને વાંસળી-વગાડનારાનો અને રણશિંગા-વગાડનારાનો
[G2532](#) [G5456](#) [G2790](#) [G2532](#) [G3451](#) [G2532](#) [G0834](#) [G2532](#) [G4538](#)

οὐ μὴ ἀκουσθῆ ἔν σοι ἔτι; καὶ παῖς τεχνίτης πάσης τέχνης, οὐ
 નહીં કદી સંભળશે માં તારામાં કદીપણ અને કોઈપણ કારીગર કોઈપણ કલાનો નહીં
[G3756](#) [G3361](#) [G0191](#) [G1722](#) [G4771](#) [G2089](#) [G2532](#) [G3956](#) [G5079](#) [G3956](#) [G5078](#) [G3756](#)

μὴ εὐρεθῆ ἔν σοι ἔτι; καὶ φωνὴ μύλου, οὐ μὴ ἀκουσθῆ ἔν
 કદી મળશે માં તારામાં કદીપણ અને અવાજ ઇંટીનો નહીં કદી સંભળશે માં
[G3361](#) [G2147](#) [G1722](#) [G4771](#) [G2089](#) [G2532](#) [G5456](#) [G3458](#) [G3756](#) [G3361](#) [G0191](#) [G1722](#)

σοι ἔτι;
 તારામાં કદીપણ
[G4771](#) [G2089](#)

And the voice of harpers and minstrels and flute-players and trumpeters shall be heard no more at all in thee; and no craftsman, of whatsoever craft, shall be found any more at all in thee; and the voice of a mill shall be heard no more at all in thee;

23 καὶ φῶς λύχνου, οὐ μὴ φάνη ἔν σοι ἔτι; καὶ φωνὴ νυμφίου
 અને પ્રકાશ દીવાનો નહીં કદી ચમકશે માં તારામાં કદીપણ અને અવાજ વરનો
[G2532](#) [G5457](#) [G3088](#) [G3756](#) [G3361](#) [G5316](#) [G1722](#) [G4771](#) [G2089](#) [G2532](#) [G5456](#) [G3566](#)

καὶ νύμφης, οὐ μὴ ἀκουσθῆ ἔν σοι ἔτι; ὅτι οἱ ἔμποροὶ σου
 અને કન્યાનો નહીં કદી સંભળશે માં તારામાં કદીપણ કારણ-કે તારા વેપારીઓ તારા
[G2532](#) [G3565](#) [G3756](#) [G3361](#) [G0191](#) [G1722](#) [G4771](#) [G2089](#) [G3754](#) [G3588](#) [G1713](#) [G4771](#)

ἦσαν οἱ μεγιστᾶνες τῆς γῆς, ὅτι ἔν τῇ φαρμακείᾳ σου, ἐπλανήθησαν
 હતા તે મહાનો આ પૃથ્વીના કારણ-કે વડે તારી જાદુગરીથી તારી ભ્રામણ-હતા
[G1510](#) [G3588](#) [G3175](#) [G3588](#) [G1093](#) [G3754](#) [G1722](#) [G3588](#) [G5331](#) [G4771](#) [G4105](#)

πάντα τὰ ἔθνη.
 બધી આ પ્રજાઓ
[G3956](#) [G3588](#) [G1484](#)

and the light of a lamp shall shine no more at all in thee; and the voice of the bridegroom and of the bride shall be heard no more at all in thee: for thy merchants were the princes of the earth; for with thy sorcery were all the nations deceived.

24 καὶ ἔν αὐτῇ, αἷμα προφητῶν καὶ ἁγίων εὐρέθη, καὶ πάντων τῶν
 અને માં તેમાં લોહી પ્રબોધકોનું અને સંતોનું મળ્યું અને બધાંનું જોયું
[G2532](#) [G1722](#) [G0846](#) [G0129](#) [G4396](#) [G2532](#) [G0040](#) [G2147](#) [G2532](#) [G3956](#) [G3588](#)

ἐσφαγμένων ἐπὶ τῆς γῆς.
 વધ-થયા-હતા ઉપર આ પૃથ્વી-પર
[G4969](#) [G1909](#) [G3588](#) [G1093](#)

| And in her was found the blood of prophets and of saints, and of all that have been slain upon the earth.